



(1)



બચ્ચોં કી સચ્ચી કહાનિયાં

# નૂર વાલા ચેહરા

Noor Wala Chehra (Gujarati)



और दूसरी 4 सचची कहानियां मअ विडियो गेम्स 

કૈમે તરીકત, ચામીરે અહલે સુખત. બાજિચે દા'વતે ઇસ્લામી. હાસત અસ્લામા મીલાના ચાદૂ રિવાઘ  
મુહમ્મદ ઇલ્યાસ અતાર કાદિરી ૨-મવી 



أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ ط  
 أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ ط بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ ط

# नूर वाला येहरा

1

बख्शी ने जब कुंओं में यूका.....

उठरते सय्यिदुना शैख मुहम्मद बिन सुलैमान  
 जमूली عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْوَالِي इरमाते हैं : मैं सहर पर था, अक मकाम  
 पर नमाज का वक्त हो गया, वहां कुंआं (Well) तो था मगर  
 डोल (Bucket) और रस्सी (Rope) नहीं थी. मैं ढसी झिक में  
 था के अक मकान के उपर से अक बख्शी ने जांका और पूछा :  
 आप क्या तलाश कर रहे हैं ? मैं ने कहा : बेटी ! रस्सी और  
 डोल. उस ने पूछा : आप का नाम ? कहा : मुहम्मद बिन



सुलैमान जजूली. बर्यी ने हैरत से कहा : अच्छा आप वोही हैं जिन की शोहरत के उंके बज रहे हैं मगर छाल येह है के कुंओं से पानी भी बाहर नहीं निकाल सकते ! येह कह कर उस ने कुंओं में थूक दिया, कमाल हो गया ! आनन शानन पानी ठीपर आ गया. आप رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ने वुजू करने के बाद उस बर्यी से इरमाया : बेटी ! सच बताओ तुम ने येह कमाल किस तरह हासिल किया ? कहने लगी : “मैं बकसरत दुर्रुदे पाक पढती हूँ, ईसी की ब-र-कत से येह करम हुवा है.” आप رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ इरमाते हैं : उस “बर्यी” से मु-तअस्सिर हो कर मैं ने वही अहद किया के दुर्रुद शरीफ के मु-तअद्विक किताब लिखूंगा. (इर उन्हों ने दुर्रुद शरीफ की किताब “दलाइलुल भैरात” लिखी) (سعادة الدارين ص ۱۰۹) अद्लाह रब्बुल ईज़्ज़त की



उन पर रहमत हो और उन के सहके हमारी बे हिसाब  
मग़ि़रत हो. **اٰمِيْن بِجَاہِ النَّبِيِّ الْاَمِيْن صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَاٰلِهٖ وَسَلَّمَ**

**صَلُّوْا عَلٰى الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلٰى مُحَمَّد**

## आशिकाने दुर्रहो सलाम के लिये ओक बेहतरीन धन्नाम

भीठे भीठे म-दनी मुन्नो और म-दनी मुन्नियो !  
**سُبْحٰنَ اللّٰه** ! देखा आप ने ! उस म-दनी मुन्नी को हमारे भीठे  
 भीठे आका मक्की म-दनी मुस्तफ़ा **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَاٰلِهٖ وَسَلَّمَ** पर  
 दुर्रहे पाक पढने की कैसी ब-र-कत मिली के उस के  
 लुआब (या'नी थूक) डालने से कुंओं का पानी बढ गया. लोले  
 लाले म-दनी मुन्नो और म-दनी मुन्नियो ! यहां इस बात  
 का जयाल रहे के उस म-दनी मुन्नी पर रब्बुल इज़्ज़त की  
 भास इनायत थी इस लिये उस ने कुंओं में अपना लुआब



(या'नी थूक) डाला, हमें पानी के किसी डौल (Pool), तालाब (Pond) या कुंओं वगैरा में नहीं थूकना चाहिए. उस म-दनी मुन्नी की तरह हमें भी अपने मक्की म-दनी आका भीठे भीठे मुस्तफ़ि صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ पर ज़ियादा से ज़ियादा दुर्रहे पाक पढने की आदत बनानी चाहिए. हम चाहे खड़े हों, खल रहे हों, बैठे हों या लैटे हुअे हों, हमारी कोशिश येही होनी चाहिए के दुर्रह शरीफ़ पढते रहें. (मस्अला : जब भी लैटे लैटे दुर्रह शरीफ़ पढ़ें या कोर्ष सा विद् करें, पाउ सभेट लेने चाहिए)

जिको दुर्रह हर घडी विद् मुभां रहे

मेरी कुजूल गोर्ष की आदत निकाल दो


صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ



# نورِ قادیا بھلرا

www.dawateislami.net

Majlis of Dawate Islami



## 2 नूर वाला येहरा

अदलाह तआला के प्यारे नबी मुहम्मदे अ-रबी  
صَلَّى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ को सभ से पहले उठरते बीबी आमिना  
رَضِيَ اللّٰهُ تَعَالَى عَنْهَا ने तकरीबन 7 दिन दूध पिलाया फिर यन्द दिन  
उठरते सुवैबा رَضِيَ اللّٰهُ تَعَالَى عَنْهَا ने, एस के बाद से उठरते बीबी  
उलीमा رَضِيَ اللّٰهُ تَعَالَى عَنْهَا ने 2 साल की उम्र तक दूध पिलाया है.

बीबी उलीमा رَضِيَ اللّٰهُ تَعَالَى عَنْهَا प्यारे प्यारे मक्की म-दनी नबी

صَلَّى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ के अरपन शरीफ के बारे में इरमाती हैं :



અલ્લાહ પાક કે પ્યારે હબીબ હઝરતે મુહમ્મદે મુસ્તફા  
 صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા પ્યારા પ્યારા નૂર વાલા ચેહરા રાત કે  
 વક્ત ઈતના ઝિયાદા ચમક્તા થા કે ઉજાલા કરને કે લિયે  
 ચરાગ (Lamp) જલાને કી ઝરૂરત ન હોતી, એક રોઝ  
 હમારી પડોસન ઉમ્મે ખૌલા સા'દિયા મુઝ સે કહને લગી : ઐ  
 હલીમા ! ક્યા આપ અપને ઘર મેં રાત કે વક્ત આગ જલાયા  
 કરતી હેં કે સારી રાત આપ કે ઘર મેં સે પ્યારી પ્યારી રોશની  
 નઝર આતી હે ! બીબી હલીમા ફરમાતી હેં, મેં ને કહા : યેહ  
 આગ કી રોશની નહીં બલ્કે હઝરતે મુહમ્મદે મ-દની  
 صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કે નૂર વાલે ચેહરે કી રોશની હે.

(માખૂઝ અઝ : તફસીરે الم نشرح , स. 107)





भीठे भीठे म-दनी मुन्नो और म-दनी मुन्नियो !

अल्लाह तआला ने अपने प्यारे हबीब हजरते मुहम्मदे

मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ को नूर से पैदा करमाया है. हमारे

हज़ूर सुल्ताने दो जहान صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ बेशक ईन्सान तो

हैं मगर नूर वाले ईन्सान और सारे ईन्सानों के सरदार हैं.


नूर वाला आया है हां नूर ले कर आया है

सारे आलम में येह देषो कैसा नूर छाया है

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ



# ਮੁਭਾਰਕ ਹਾਥ ਔਰ ਭੀਮਾਰ ਓਂਟ ਯਾ ਭੜਰੀ



### 3 मुबारक हाथ और बीमार छिंट या बकरी

उठरते बीबी उलीमा رَضِيَ اللهُ تَعَالَى عَنْهَا इरमाती हैं :

अल्लाह तआला के नबी उठरते मुहम्मदे म-दनी  
 صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ को ले कर जब मैं अपने मकान में दाखिल  
 हुँ तो कभीलअे बनू सा'द के घरों में से कोई घर ऐसा न रहा  
 जिस से हमें मुश्क (Musk) की ખुश्बू न आने लगी हो और  
 लोगों के दिलों में अल्लाह के प्यारे उबीब उठरते मुहम्मदे  
 MUSTAFA صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ की महबूबत घर कर गई और  
 आप صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ की ब-र-कत का यकीन इस कदर  
 मजबूत हो गया के अगर किसी के बदन में कहीं दद या  
 तकलीफ हो जाती तो वोह आप صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآलِهِ وَسَلَّمَ का हाथ  
 मुबारक ले कर तकलीफ की जगह पर रखता तो अल्लाह



तआला के हुकम से उसी वक्त ठीक हो जाता, अगर उन का कोई ठिंठ या बकरी बीमार हो जाती तो उस पर हुज़ूर صَلَّى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का मुबारक हाथ डेरते वोह तन्दुरुस्त हो जाती. (السيرة الحلبية ج 1 ص 130)

## मुबारक हाथ के 8 हैरत अंगेज कमावात

भीठे भीठे म-दनी मुन्नो और म-दनी मुन्नियो !  
 देखा आप ने ! अल्लाह तआला के प्यारे हबीब صَلَّى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ के मुबारक हाथ की भी क्या भूषण बहारें हैं !  
 आँये ! प्यारे आका मक्की म-दनी मुस्तफ़ा صَلَّى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ के मुबारक हाथ के 8 और मो'जिआत आप को सुनाओं : ❁ अक गज़्वे<sup>1</sup> के मौकअ पर तीर लगने के सबब प्यारे सहाबी دِينِهِ

1 : या'नी कुड़कार से लडी जाने वाली ऐसी जंग जिस में हमारे हुज़ूर صَلَّى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ शामिल हुअे हों उसे "गज़वा" कहते हैं.



उठरते कतादा رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ की आंख मुबारक बाहर निकल पडी, सभ तबीबों के तबीब, अल्लाह तआला के प्यारे हबीब صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने उन की आंख अपने मुबारक हाथ में ली और उस की जगह पर रख कर हुआ इरमाई तो वोह आंख दुरुस्त हो कर दूसरी आंख से जियादा रोशन हो गई ❁ अक काफ़िला अल्लाह पाक के प्यारे नबी की बारगाहे बेकस पनाह में हाजिर हुवा, उन में से अक शप्स की तबीअत खराब थी, उस को दौरे पडते थे. सरकारे नामदार صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने उस की पीठ पर अपना हाथ मुबारक मार कर (उस मरीज के अन्दर मौजूद “बला” से) इरमाया : “ओ अल्लाह के दुश्मन निकल जा” फिर उस के येहरे पर



हाथ मुबारक ફેरा तो वोह मरीज अैसा हो गया के आने वाले काङ्किले में उस से बेहतर कोरु नजर ही न आता था ❁

अेक प्यारे सहाबी हजरते सय्यिदुना अब्दुल्लाह बिन अतीक رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ के पाउं की टूटी हुंरु पिंडली (Shin) पर अब्दुल्लाह तआला के प्यारे हबीब صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने अपना हाथ मुबारक ફेरा तो अैसी सहीह हो गरु जैसे कुंरु हुंवा ही न था ❁ अेक प्यारे सहाबी हजरते सय्यिदुना अब्दुल्लाह बिन हम्माल رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ के येयक (या'नी अेक बीमारी जिस में मुंह पर दाने निकल आते हैं) वाले येहरे पर हाथ मुबारक ફेरा तो इौरन येहरा ठीक हो गया और येयक के दानों के निशानात जाते रहे ❁ आ'ज सहाबअे किराम الرضوان को




અલગ અલગ મોકલ પર અપને મુબારક હાથ સે લકડી યા દરખ્ત કી ટહની (શાખ) દી તો વોહ તલવાર બન ગઈ ! ❁  
 કિસી કે ચેહરે પર અપના મુબારક હાથ ફેરા તો ચેહરા રોશન હો ગયા ❁ કિસી બીમાર પર હાથ ફેરા તો મરઝ દૂર હોને કે સાથ સાથ ઉસ કા બદન ખુશબૂદાર ભી હો ગયા ❁ એક સહાબી હઝરતે સય્યિદુના ઉસ્માન બિન અબુલ આસ રَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કે સીને પર હાથ મુબારક ફેરા તો હાફિઝા (Memory) એક દમ મઝબૂત હો ગયા. (البرهان ص ۳۷۳-۳۷۴ ملخصاً)

ઝરા ચેહરે સે પદા તો હટાઓ યા રસૂલલ્લાહ !

હમં દીદાર તો અપના કરાઓ યા રસૂલલ્લાહ !

صَلُّوا عَلَيَّ الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ





ગોયા ઊંટની બોલ ઉઠી!



## 4 गोया ठिंटनी बोल उठी !

अल्लाह तआला के प्यारे नबी صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ के यथाजान के शहजादे और बहुत ही प्यारे सहाबी उजरते सय्यिदुना अब्दुल्लाह इब्ने अब्बास رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا इरमाते हैं: बयपन शरीफ में अक बार सरकारे नामदार صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ मक्के शरीफ की घाटियों (या'नी दो पहाड़ों के दरमियानी रास्ते) में अपने दादाजान उजरते सय्यिदुना अब्दुल मुत्तलिब رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ से जुदा हो गये, (बा'दे तलाश) दादाजान वापस मक्के शरीफ आये और का'बा शरीफ के पर्दों से लिपट कर छुजुरे अकरम صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ के मिल जाने के लिये रो रो कर दुआओं मांगने लगे. इसी दौरान मशहूर काफिर अबू जह्ल ठिंटनी पर सुवार अपनी बकरियों के रेवड (Herd of goats) से वापस आ रहा था, उस ने हमारे प्यारे आका मुहम्मद मुस्तफा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ को देख लिया, अबू जह्ल



ને અપની ઊંટની બિઠાઈ ઓર સરકારે નામદાર  
 صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કો અપને પીછે બિઠા કર ઊંટની કો ઉઠાના  
 યાહા તો વોહ ન ઉઠી ! ફિર જબ અપને આગે બિઠાયા તો  
 ઊંટની ખડી હો ગઈ ઓર ગોયા અબૂ જહૂલ સે કહને લગી :  
 “અરે બે વુકૂફ ! યેહ તો ઈમામ હૈં, મુક્તદી કે પીછે કેસે હો  
 સકતે હૈં !” હઝરતે સય્યિદુના અબ્દુલ્લાહ ઈબને અબ્બાસ  
 رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا મઝીદ ફરમાતે હૈં : અલ્લાહ عَزَّوَجَلَّ ને હઝરતે  
 સય્યિદુના મૂસા કલીમુલ્લાહ عَلَيْهِ السَّلَام وَالصَّلَاةُ وَالسَّلَام કો જિસ તરહ  
 ફિરઔન કે ઝરીએ ઉન કી અમ્મીજાન તક પહુંચાયા ઈસી  
 તરહ અબૂ જહૂલ કે ઝરીએ સરકારે દો જહાન صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ  
 કો અપને દાદાજાન તક પહુંચાયા. (روح المعاني، جزء ٣٠ ص ٥٣٢)

**ઇસ સચ્ચી કહાની સે મિલને વાલે મ-દની ફૂલ**

મીઠે મીઠે મ-દની મુન્નો ઓર મ-દની મુન્નિયો ! દેખી  
 આપ ને અલ્લાહ તઆલા કી કુદરત ! અબૂ જહૂલ કે ઝરીએ



अल्लाह तआला ने अपने प्यारे उबीय صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ को उन के दादाजान तक पहुंचा दिया. यकीनन अल्लाह तआला जो याहता है वोह करता है. येह भी मा'लूम हुवा के जानवर तो रसूले करीम صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ की ता'जीम समझते हैं मगर बुरा हो उन ना लाईक ईन्सानों का जो ता'जीमे मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ को नहीं समझते. वलिय्ये कामिल और सय्ये आशिके रसूल आ'ला उजरत मौलाना शाह ईमाम अहमद रज़ा पान رَحْمَةُ الرَّحْمَنِ अपने ना'तिया दीवान "उदाईके अफ़िशिश शरीफ़" सफ़हा 112 पर इरमाते हैं:

अपने मौला की है अस शान अजीम जानवर भी करें जिन की ता'जीम संग करते हैं अदब से तस्वीम पेउ सजदे में गिरा करते हैं

**शर्ह कलामे रज़ा:** या'नी हमारे आका व मौला मक्के मदीने वाले मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ की प्यारी प्यारी शान तो देओ ! जानवर ईन का अहतिराम करते हैं, पथर अदब से सलाम करते हैं और दरभ्त ईन्हें सजदा करते हैं.

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ



صَلَّى اللّٰهُ تَعَالَى  
عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

آسکا نے پاڻی کی ٹوکر سے  
پانی کا رخما جاری کر دیا



## 5 आका صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने पाठं डी ठोकर से पानी का यश्मा जारी कर दिया

अल्लाह तआला के प्यारे उबीन صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ के यथा अबू तालिब का कहना है के अेक मर्तबा में अपने भतीजे या'नी नबिये पाक صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ के साथ “जुल मजाल” के मकाम पर था के अयानक मुझे प्यास लगी. मैं ने मुहम्मद मुस्तई (صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ) से अर्ज की : “अै मेरे भतीजे ! मुझे प्यास लगी है.” मैं ने उन से येह बात ँस लिये नहीं कही थी के उन के पास पानी वगैरा था बल्के सिई अपनी परेशानी आहिर करने के लिये कह दिया था. अबू तालिब कहते हैं के मेरी बात सुन कर वोह झोरन अपनी सुवारी से नीचे उतरे और ँशाद इरमाया : “अै यथा !



क्या प्यास लगी है ?” मैं ने अर्ज की : ओ हां. येह सुन कर उठरते मुहम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने अपनी मुबारक ओडी जमीन पर मारी जिस की ब-र-कत से उस मकाम से ओक दम पानी निकल पडा ! फिर मुज से एर्शाद इरमाया : “ओ यथा ! पानी पी लो,” तो मैं ने वोह पानी पिया. (الطبقات الكبرى لابن سعد ج ١ ص ١٢١، ابن عساکر ج ٦٦ ص ٣٠٨)

पाँउ के नीचे के जोड की उभरी छुँ छड़ी को टप्ना (Ankle) और टप्ने के नीचे पैर की गद्दी का हिस्सा ओडी (Heel) कहलाता है.

तेरी ढोकर से यश्मा या रसूलव्वाह हुवा ज़री

करम से अपने मेरी दूर इरमा मुश्किलें सारी

صَلُّوا عَلَيَّ الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ



# में विडियो गेम का आधी था



## में विडियो गेम का आदी था

शकर गढ ज़िलअ नारोवाल (सूबअे पंजअ पाकिस्तान) के अेक ईस्लामी भाई का बयान है के मैं बचपन में विडियो गेम में रोजाना घन्टों वक्त जाअेअ किया करता था, नमाज़ों की अदाअेगी का कोई मा'भूल नहीं था. मेरी किस्मत का सितारा उस वक्त यमका जब मेरे वालिदे मोहतरम ने मुझे मद्र-सतुल मदीना में दाखिल करवा दिया, **اللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَىٰ سَيِّدِنَا مُحَمَّدٍ** मैं ने वहां पहले कुरआने पाक नाज़िरा ખत्म किया, ईस के बा'द हाज़िरे कुरआन बना और साथ ही साथ मेरी अज्लाकी तरबियत का भी सिखिसला हुवा. **اللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَىٰ سَيِّدِنَا مُحَمَّدٍ** दा'वते ईस्लामी के मद्र-सतुल मदीना की ब-र-कत से मैं पंजवक्ता नमाज़ों का पाबन्द हो गया और सुन्नतों बरा म-दनी लिबास पहनने लगा. कल तक पांथों नमाज़ें छोड देने वाला





अल्लाह عَزَّوَجَلَّ की रहमत से अब तहज्जुद और ईशराक व याशत के नवाझिल की बहारें लूटने वाला बन गया. जब मुझे दा'वते ईस्लामी की ब-र-कतें मिलीं तो मैं ने अेक म-दनी मुन्ने के वालिद साहिब पर इन्फिरादी कोशिश की के आप भी अपने बेटे को मद्र-सतुल मदीना में दाजिल करवा दीजिये. पहले तो उन्हों ने इन्कार किया फिर जब मैं ने उन्हें अपनी मिसाल दी के मैं कल तक नमाज नहीं पढता था, नंगे सर धूमता था मगर **اللَّهُمَّ الْحَمْدُ** आज दा'वते ईस्लामी के तुझैल मेरे सर पर ईमामा शरीफ है और मैं पांयों नमाजों की पाबन्दी करने वाला बन गया हूं तो उन्हों ने अपने बेटे को मद्र-सतुल मदीना में दाजिला दिलवा दिया जहां उस ने पहले कुरआने करीम नाजिरा पढा और अब हिफ्ज करने की सआदत पा रहा है जब के मैं ता दमे तहरीर **اللَّهُمَّ الْحَمْدُ** जामिअतुल मदीना



में दर्से निजामी का तालिबे एल्म हूं.

अल्लाह करम ऐसा करे तुम पे जहां में  
ऐ दा'वते इस्लामी तेरी धूम मयी हो

(वसाएले बज्शिश, स. 193)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## विडियो गेम

भीठे भीठे म-दनी मुन्नो और म-दनी मुन्नियो !  
देखा आप ने के विडियो गेम की लत में मुत्तला बर्ये को जब  
दा'वते इस्लामी के मद्र-सतुल मदीना का म-दनी माहोल  
मिला तो वोह नेक नमाजी और परहेज गार “म-दनी  
मुन्ना” बन गया. आप भी दा'वते इस्लामी के म-दनी  
माहोल से हमेशा वाबस्ता (Attach) रहिये. अगर खुदा न  
ज्वास्ता आप विडियो गेम की आदत में मुत्तला हैं तो हाथों  
हाथ उस की आदत छुड़ाने की कोशिश कीजिये.



## विडियो गेम के ऋरीओे दीन व ँमान का नुकसान

बहुत कम म-दनी मुन्नों को ँस बात का ओहसास ढोगा के मुसल्मानों की नँ नस्लों को तबाह करने के लिये दुश्मनाने ँस्लाम ओसी ओसी गेम्न तय्यार कर रहे हैं के बय्या षेल ही षेल में न सिई अ-मलन ँस्लाम से दूर यला जाओे बल्के **مَعَادِئِ اللَّهِ** उस के दिल में दीने ँस्लाम ही की नँरत बैठ जाओे म-सलन विडियो गेम षेलने वाला जिस किस्म के किरदारों को स्क्रीन पर देषता है उन में ओसे किरदार भी शामिल ढोते हैं जिन के ढाथों ँस्लामी हुल्ये म-सलन दाढी और टोपी या ँमामे में मल्बूस “किरदारों” को मरवाया जाता है या किर ँस्लामी किरदारों को “दहूशत गर्द” के रूप में पेश किया जाता है, ँस किस्म की गेमें षेलने वाले के दिल में



ईस्लाम की महबूबत बढ़ेगी या कम होगी ! इस का जवाब आप खुद ही अपने ऊपर से हासिल कीजिये.

## विडियो गेम्स से होने वाली बीमारियां

विडियो गेम्स खेलने वाला नज़र की कमजोरी, पक्षों (Muscles) के झिंझाव और सर दर्द जैसे अमराज़ में मुब्तला हो सकता है.

## विडियो गेम्स की लम्बा पैर तबाह कारियां

हया सोज़ लिबास में मलबूस विडियो गेम के किरदारों को देख देख कर बच्चों की जेहूनी पाकीज़गी बे हयाई के गन्दे नाले में डूब जाती है और बह निगाही का मरज़ उन की नस नस में उतर जाता है, “विडियो गेम्स क्लब” पर मुनशियात इरोशों की “भास नज़र” रहती है, कई बच्चे



ઔર નૌ જવાન ઉન કે ચુંગલ મેં ફંસ જાતે હૈં ઔર બા'ઝ તો ઐસા ફંસતે હૈં કે ઉન કો ઉમ્ર ભર રિહાઈ નસીબ નહીં હોતી, ઐસે મકામાત પર બચ્ચોં સે “ગન્ઢે કામ” ક્રિયે જાતે હૈં ખુસૂસન વોહ બચ્ચે બદકાર લોગોં કી હવસ કા શિકાર બનતે હૈં જો ઘર વાલોં સે છુપ કર વિડિયો ગેમ ખેલતે હૈં. મારઘાડ ઔર કત્લો ગારત ગરી કે મનાઝિર સે ભરપૂર ગેમ ખેલ ખેલ કર બચ્ચોં મેં રહ્મ દિલી, સબ્ર, મુઆફી ઔર દર ગુઝર કા જઝબા કમ યા ખત્મ હો જાતા હૈ ઔર દેખી હુઈ ચીઝોં કા અ-મલી મુઝા-હરા કરને કે શૌક મેં કચ્ચી ઉમ્ર કે નૌ જવાન (Teenager યા'ની 13 સે 19 સાલ વાલે) લૂટમાર, ચોરી ચકારી, ગન્ઢે કામોં, હતા કે કત્લ જૈસે જરાઈમ મેં મુલવ્વસ હો જાતે હૈં !



## विडियो गेम्स कत्लो गारत सिजाते हैं

विडियो गेम्स अक्सर जुल्म व तशदुद के मनाजिर से भरपूर होते हैं, बा'ज गेमों में वोह लोग भी “हीरो” की झायरिंग का निशाना बनते दिजाये जाते हैं जो घुटनों के बल बैठ कर गिड-गिडाते हुअे उस से रहूम की दर-ज्वास्त करते और मौत से बचने के लिये यीजो पुकार मया रहे होते हैं, लेकिन विडियो गेम खेलने वाला झईनल राउन्ड तक पछोंयने के लिये उन सब को बन्दूक की गोलियों से भूनता हुवा आगे बढ़ता यला जाता है. हर तरफ़ भून ही भून दिजाई देता है और गेम खेलने वाला झन तमाम मनाजिर से लुत्फ़ अन्दोज होता है. बा'ज गेमों में “हीरो” कार (Car) में सुवार हो कर लोगों को कुयलता हुवा यला जाता है, बा'ज गेमों में झन्सान को जब्द करने और सर काटने के हैबत नाक मनाजिर दिजाये



जाते हैं, बा'ज गेमों में मकानात और पुल बम धमाकों से उड़ाने के मनाज़िर दिखाए जाते हैं. क्या ये सब कुछ बच्चों के कय्ये जेहन के लिये नुकसान देह नहीं? अगर ये सब कहा जाये तो शायद बे जा नहोगा के इस वक्त मुआ-शरे में तेज़ी के साथ बढ़ने वाले जराईम में विडियो गेम्स का निहायत गहरा तअल्लुक है!

## अमरीकियों का अे'तिराफ़

\*अमरीका में की गई अेक रीसर्च के मुताबिक 80 ईसद नौ जवान भारधाउ और तशदुद से भरपूर गेम्स खेलना पसन्द करते हैं. अेक अमरीकी माहिरे नईसियात का कहना है : "हम कम्प्यूटर गेम को महज़ खेल समज़ते हैं लेकिन बह किस्मती की बात ये है के ये हमारे मुआ-शरे को



गलत सम्त ले कर जा रहे हैं और हम अपने बच्चों को कम्प्यूटर गेम के जरीअे वोह सब कुछ सिखा रहे हैं जो किसी और तरीके से बहुत ढेर में सीखा जा सकता है, कम्प्यूटर की मदद से बच्चे न सिर्फ जदीद (या'नी नअे) हथियारों के इस्ति'माल में महारत हासिल कर लेते हैं बल्के इस के साथ साथ वोह इन्सानों और दूसरे जानदारों को गोदियों का निशाना बनाना भी सीख लेते हैं."

### विडियो गेम की नुहूसत के 14 छब्रत नाक वाकिआत

(लोगों और विडियो गेम के नाम हज़ूफ़ कर दिये गअे हैं)

❁ कोलम्बियन हाई स्कूल के 17 और 18 सालह ढो<sup>2</sup> तालिबे इल्मों ने 20 अप्रील 1999 ई. को 12 स्टूडन्ट्स और अेक टीचर को कत्ल कर दिया, येह ढोनों तालिबे इल्म अेक विडियो गेम की लत में मुज्तला थे और इन्हों ने येह घिनाउना इे'ल उसी विडियो गेम के अन्दाज में किया





❁ અપ્રિલ 2000 ઈ. મેં 16 સાલહ સ્પેનિશ (SPANISH) લડકે ને એક વિડિયો ગેમ કે હીરો કી નક્લ કરતે હુએ સચમુચ અપને માં બાપ ઓર બહન કો “કાટાના તલવાર” સે કત્લ કર દિયા ! ❁ નવમ્બર 2001 ઈ. મેં 21 સાલહ અમરીકી નૌ જવાન ને ખુદકુશી કર લી, ઉસ કી માં કા કહના થા કે વોહ એક વિડિયો ગેમ કો નશે કી હદ તક ખેલતા થા ❁ ફરવરી 2003 ઈ. મેં 16 સાલહ અમરીકી લડકે ને એક વિડિયો ગેમ સે મુ-તઅસ્સિર હો કર એક બચ્ચી કો કત્લ કર દિયા ❁ 7 જૂન 2003 ઈ. કો 18 સાલહ નૌ જવાન ને એક વિડિયો ગેમ સે મુ-તઅસ્સિર હો કર દો પોલીસ વાલોં કો ગોલી માર કર હલાક કર દિયા, બિલ આખિર ઉસે ચોરી કી કાર સમેત ગિરિફતાર કર લિયા ગયા ❁ દો<sup>2</sup> અમરીકી સોતેલે ભાઈયોં ને જિન કી ઉમ્ર 14 ઓર 16 સાલ થી, 25 જૂન



2003 ઈ. કો એક રાઈફલ કે ઝરીએ 45 સાલહ ઔરત કો હલાક ઔર 16 સાલહ લડકી કો ઝખ્મી કર દિયા, યેહ દોનોં એક ગેમ કી નક્લ કર રહે थे ❁ લેસ્ટર બરતાનિયા મેં 27 ફરવરી 2007 ઈ. કો 17 સાલહ નૌ જવાન ને 14 સાલહ લડકે કો પાર્ક મેં લે જા કર હથોડે (Hammer) ઔર છુરી કે પૈ દર પૈ વાર કર કે હલાક કર દિયા, તહકીકાત સે પતા ચલા કે વોહ એક વિડિયો ગેમ સે મુ-તઅસ્સિર થા ❁ 27 દિસમ્બર 2004 ઈ. કો 13 સાલહ લડકે ને 24 મન્જિલા ઈમારત સે છલાંગ લગા કર ખુદકુશી કર લી, મૌત સે કબ્લ વોહ 36 ઘન્ટે સે મુસલ્સલ એક વિડિયો ગેમ ખેલ રહા થા ❁ અગસ્ત 2005 ઈ. કો “જનૂબી કોરિયા” કા એક શપ્સ 50 ઘન્ટે તક મુસલ્સલ એક વિડિયો ગેમ ખેલતા રહા.



ઔર ખેલતે ખેલતે મૌત કા શિકાર હો ગયા ❁ જનવરી 2006 ઈ. કો ટોરન્ટો (કેનેડા) કી સડકોં પર 18 સાલહ દો નૌ જવાન લડકોં ને એક વિડિયો ગેમ કી નક્લ કરતે હુએ કાર કી રેસ કી શર્ત લગાઈ ઔર ઈસ રેસ કે દૌરાન હોને વાલે હાદિસે મેં એક ટેક્સી ડ્રાઈવર અપની જાન સે હાથ ધો બૈઠા ❁ સિતમ્બર 2007 ઈ. મેં ચીન કા એક શપ્સ ઈન્ટરનેટ પર મુસલ્સલ તીન દિન સે ઑન લાઈન ગેમ ખેલતા રહા, બિલ આબિર ખેલ કે ઈસ નશે ને ઉસ કી જાન લે લી ❁ દિસમ્બર 2007 ઈ. મેં એક રૂસી શપ્સ ને એક વિડિયો ગેમ કી તરહ સયમુય મેં ફાયટિંગ (યા'ની મારઘાડ) કી શર્ત રખી ઔર ઈસ ઝગડે મેં મારા ગયા ❁ 14 અપ્રીલ 2009 ઈ. કો 9 સાલહ બચ્યા જો કે બ્રોકલન, ન્યૂયોર્ક મેં રહતા થા એક ગેમ કી



નક્કાલી કરતે હુએ એક આરિઝી પેરાશૂટ લે કર છત સે કૂદા  
ઔર મૌત કે ઘાટ ઉતર ગયા ❁ માર્ચ 2010 ઈ. મેં તીન<sup>3</sup>  
સાલહ બચ્ચી અપને બાપ કી બન્દૂક કો ગેમ કા “રીમોટ”  
સમઝ કર ચલાને લગી ઔર એક ગોલી સે ઉસ કી જાન ચલી  
ગઈ. (યેહ સબ ખબરેં નેટ પર જનરેશન નેક્સ્ટ ઓન લાઈન  
મેગેઝીન, અક્તૂબર 2010 ઈ. સે લી ગઈ હેં)

મીઠે\*મીઠે મ-દની મુન્નો ઔર મુન્નિયો\*! વિડિયો  
ગેમ્ઝ કે દીની વ દુન્યવી નુક્સાનાત આપ ને પઢે, અબ અચ્છે  
બચ્ચે બનતે હુએ હમેશા હમેશા કે લિયે વિડિયો ગેમ્ઝ ખેલને  
સે દૂર રહને કા ઝેહન બના લીજિયે, ઈસ મેં આખિરત કી  
ભલાઈ કે સાથ સાથ આપ કે પૈસોં ઔર કીમતી વક્ત કી ભી



भयत है. या अस्वाह عَزَّوَجَلَّ ! तुझे तेरे प्यारे हबीब

صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का वासिता ! मुसल्मानों को विडियो गेम

देखने दिखाने की गन्दी आदत से छुटकारा अता इरमा.

“विडियो गेमों” से जुदाये पाक सब बर्ये बर्ये  
नेकियां करते रहें अर्ये बनें सर्ये बनें

صَلُّوْا عَلَيَّ الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

**म-दनी इल**

यकने या सीढी यकने उतरने में  
येह अउतियात कीजिये के जूतों  
की आवाज पैदा न हो.

तालिबे गमे मदीना व  
बकीअ व मगिरत व  
बे हिसाब जन्नतुल  
इरदौस में आका  
का पडोस



7 शा'बानुल मुअज़्जम 1434 सि.हि.

17-6-2013



الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ أَدَا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

## म-दनी मुन्नों के विये बहुत काम के म-दनी कूल

लैटे लैटे या यलते यलते या यलती गाडी में या धूप के अन्दर या बहुत तेज या बहुत कम रोशनी में किताब पढने से नजर कमजोर होती छे. आ'ज म-दनी मुन्ने और म-दनी मुन्नियां अेक हम जुक कर मुता-लआ करने या बिपने या पाना पाने के आदी छोते छैं, मेहरबानी कर के वोह अपनी आदत तब्दील करें वरना आंभें कमजोर, बदन के पड़े और केंकडे पराब और कमर में तकलीफ और जुकाव पैदा हो जाने का खतरा छे.

(येह म-दनी कूल अों के विये भी फायेदा मन्द छैं)



**मठ-त-अतुल मदीना®**

दा'वते ईस्लामी

ईराने मदीना, श्री डोनिया बगीचे के सामने, मिरजापूर, अहमदाबाद, गुजरात, इन्डिया  
Mo.091 93271 68200 E-mail : maktabaahmedabad@gmail.com www.dawateislami.net

